

May 9, 2022

To,

#### **BSE Limited**

Department of Corporate Services, P. J. Towers, Dalal Street, Mumbai – 400 001 (Scrip Code-508933)

#### **National Stock Exchange of India Limited**

Exchange Plaza, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai – 400 051 (Symbol: AYMSYNTEX)

Dear Sir,

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed the E-newspaper copies of the Audited Financial Results of the Company for the year ended on 31st March, 2022 published in The Financial Express (English), Ahmedabad edition on Sunday, 8th May 2022 and The Financial Express (Gujrati), Ahmedabad edition on Monday, 9th May, 2022.

This is for your information and record.

Thanking you,

Yours faithfully, **AYM Syntex Limited** 

**Ashitosh Sheth Company Secretary ACS 25997** 

**FE SUNDAY** 



The Indian Express. For the Indian Intelligent.



DOWN.

AYM SYNTEX LIMITED

Regd Off: Survey No. 374/1/1, Saily, Silvassa- 396230 (U. T. of Dadra & Nagar Haveli) **Tel:**+ 91-22-61637000/61637001 **Fax:** +91-22-24937725; **Email id:** complianceofficer@aymgroup.com

Sr.	PARTICULARS	QU	JARTER END	YEAR ENDED		
No.		31.03.2022	31.12.2021	31.03.2021	31.03.2022	31.03.202
			(Unaudited)		(Audited)	
1	Total income from operations (net)	40,742	40,095	35,126	1,49,582	95,022
2	Net Profit / (Loss) for the period					
- 1	(before Tax, Exceptional and/or Extraordinary items#)	2,206	2,243	2,457	7,957	1,738
3	Net Profit / (Loss) for the period before tax					
- 1	(after Exceptional and/or Extraordinary items#)	2,206	2,243	2,457	7,957	1,738
4	Net Profit / (Loss) for the period after tax					
- 1	(after Exceptional and/or Extraordinary items#)	1,397	1,437	1,878	5,081	1,409
5	Total Comprehensive Income for the period [Comprising					
	Profit / (Loss) for the period (after tax) and Other					
	Comprehensive Income (after tax)]	1,396	1,442	1,802	5,094	1,380
6	Paid up equity capital (Face value of Rs. 10 each)	5,015	5,015	5,004	5,015	5,004
7	Reserves (excluding Revaluation Reserve)	-	-	-	35,982	30,762
8	Earnings Per Share (before extraordinary items)					
	(of Rs 10/- each)					
	Basic:	2.79	2.86	3.66	10.14	2.82
	Diluted:	2.75	2.82	3.65	10.01	2.81

Notes: The above is the extract of the detailed format of Quarter/ Year ended Financial results filed with the Stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the Quarter/ Year ended Financial results are available on the BSE website (www.bseindia.com), NSE website (www.nseindia.com) and on

the Company's website(www.aymsyntex.com). # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules / AS

Rules, whichever is applicable. For and on behalf of Board of Directors

Place: Mumbai Date : May 07, 2022

Abhishek Mandawewala Managing Director & CEO DIN: 00737785

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

SOLA ROAD BRANCH, A.P.M SHOPPING MALL, OPP. SUN-N-STEP CLUB, SOLA ROAD, AHMEDABAD-380061, GUJARAT PHON: 91 079 27495100, (D) 27495200, EMAIL:solahm@bankofbaroda.com

POSSESSION NOTICE APPENDIX-IV (FOR IMMOVABLE PROPERTY) [SEE RULE 8(1)]

Whereas, The undersigned being the Authorized Officer of Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 24.01.2022, calling upon the Borrower M/s. Ravi Sheet Processors Pvt. Ltd. and its Guarantors / Mortgagors, viz., Mr. Narendrabhai G. Patel, Mr. Tusharkumar Narendrabhai Patel, Mr. Saurabh Narendrabhai Patel and Mrs. Jyotsnaben N. Patel to repay the amount mentioned in the notice aggregating Rs.12,30,25,809.26ps. (Rupees Twelve Crores Thirty Lakhs Twenty Five Thousand Eight Hundred Nine and Paise Twenty Six Only) together with further interest thereon as stated in the notice till the date of payment and cost, charges and expenses within 60 days from the date of receipt of the said notice.

The borrower/guarantors having failed to repay the amount, notice is hereby given to the borrower/guarantors and the public in general that the undersigned has taken **symbolic possession** of the properties at sr. no. A,B,C and D and physical possession of the property at sr. no. E described hereinbelow in exercise of powers conferred on him under sub-section (4) of Section-13 of Act read with Rule-8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 2nd day of May of the year, 2022.

The borrower / guarantors / mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the properties will be subject to the charge of Bank of Baroda for the amount of Rs.10,01,35,147.71ps. ('A' property) Rs.12,30,25,809.26ps. ('B' & 'C' properties) and Rs.2,28,90,661.55ps. ('D' & 'E' properties)

The borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured

# **DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES**

A. All the piece and parcel of the property being non-agricultural land bearing Block No.514/2 paiki Plot No.4 adm. about 1358 Sq. mtrs. situated lying and being at mouje Rakanpur, Taluka Kalol in the registration District Sub-District of Gandhinagar On towards East: Naliyu and Block No.512

On towards West: 7.5 Sq. mtr. road and S. Kumar On towards North : Block No. 514 paiki Shri Yogesh Khadi

On towards South: M/s. Laxmi Metal Factory B. All that piece and parcel of immovable property bearing Residential Bungalow No.77 consisting of Plot admeasuring about 180 sq.mts, alongwith construction admeasuring about 148.39 sq.mts., thereon in the Scheme known as 'Someshwar Park-3" of Cozy Corner Co-operative Housing Society Ltd, Vibhag-I, situate lying and being at Revenue Survey No.86, 90, Final plot No.15, 18 and 44 of T.P. Scheme No.1 Mouje: Thaltej, Tal. Dascroi in the Registration District and Sub-District Ahmedabad-9 (Bopal) standing in the name of 1) Mrs. Jyotsnaben Narendrabha Patel 2) Mr. Tusharkumar Narendrabhai Patel and 3) Mr. Saurabhkumar

Narendrabhai Patel, which is bounded as under On or towards East: T.P. Road and Nadheshwar Society.

On or towards West : Bungalow No.76. On or towards North : Bungalow No.78.

On or towards South : Cozy Corner Complex C. All that piece and parcel of immovable property being Flat E/5, in "E" Wing on 1s floor, of "Safal Avenue", situated on N.A. land Revenue Block No. 763 paiki Village Dedivasan, Tal. & Dist. Mehsana having super-built up area of 83.64 sq.mts. with proportionate share in the land of the apartment about 15.17 sq.mts. standing in the

name of Jyotsnaben Narendrabhai Patel (Guarantor) and is bounded as follows

On or towards East : Adj. Open Sky land of Margin On or towards West : Adj. Flat No. E/6 with co ownership wall of this Flat On or towards North : Adj. margin land and Open Sky part of TP road

On or towards South : Adj. Flat No. E/4 with co ownership wall of this Flat D. Office No. 14(614), 6th Floor, admeasuring about 340 sq.ft. in the scheme known

as "Loha Bhavan Building Association" situate lying and being at Sub-Plot no. 18, 19 and 20 of Final Plot no. 169. TP Scheme No. 3 mouje Sheikhpur-Khanpur, taluka city in the Registration District and Sub-District of Ahmedabad-3 (Memnagar) in the name of Narendrabhai G. Patel.

E. All that piece and parcel of non-agricultural land bearing Block No. 388/2 (Old R.S. No. 386) admeasuring 5463 sq.mts. situate at Village Nandidau, Taluka and Dist. Mehsana standing in the name of Narendrabhai Gangaram Patel and bounded

On or towards North: The field of Kalyanji Hemaji Thakor On or towards South: The field of Shivaji Karsanji Thakor On or towards East: Railway Line and The field of Shivaji Karsanji Thakor

On or towards West: The field of Jaguji Kachraji Thakor Date: 02/05/2022 **Authorized Officer** Place: Ahmedabad **BANK OF BARODA**  Kudsad Branch, At & Po. Kudsad, Tal.Olpad - 394110, Dist.Surat, E-mail: kudsad@bankofbaroda.com Ph.No.8980026715



**POSSESSION NOTICE (Immovable Property)** 

Whereas, The undersigned being the Authorised Officer of the Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated **04.01.2022** calling upon the Borrower **Mr.Manhar** Mulchandbhai Patel & its Guarantors Mr. Janakbhai Mohanbhai Patel to repay the amount mentioned in the notice being Rs.11,76,621 (Rupees Eleven Lakhs Seventy Six Thousand Six Hundred Twenty One Only) Plus Interest & other charges, and nterest thereon w.e.f. 31.10.2019 within 60 days from the date of receipt of the said

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrowe and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on this **2**<sup>nd</sup> **Day of May of the year** 

The borrower's attention is invited to provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge o Bank of Baroda, Kudsad Branch, Surat for an amount of Rs.11,76,621 (Rupees Eleven Lakhs Seventy Six Thousand Six Hundred Twenty One Only) Plus other

charges, and interest thereon. Description of the immovable property

Place: Palanpur

All Piece and Parcel of the Gramtal Bearing Panchayat Property Registration No.184, Admeasuring about: 2712.50 sq.fts. i.e. 251.95 sq.mtrs. Situatede at of Village Umra, Tal: Olpad, Dist: Surat. And surrounding on all sides: North by: Road for Para Faliya, South by: Property of Harijanvash, East by: Property of Manharbhai M.Patel, West: Property of Keshavbhai L.Patel Chief Manager & Authorised Officer, Date : 02/05/2022 | Place : Kudsad, Surat Bank of Baroda

(मल्टीस्टेट-शेडपुल्ड बेंक) The Nasik Merchants Co.- Op. Bank Ltd., Nasik

Administrative Office: A-16, Babubhai Rathi Chowk, M.I.D.C. Subhashchandra Bose Marg, Satpur, Nashik - 422007. Phone No: 0253 - 2308200 to 2308206, • Fax No. 0253-2353581

**AUCTION SALE NOTICE UNDER SARFAESI ACT - 2002** 

Authorized officer of The Nasik Merchant's Co. Op. Bank Ltd., Nashik (Multi - State Scheduled Bank) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (54 of 2002) and in exercise of power confirmed under the said Act issued Demand Notice, calling upon following Borrowers / Guarantors to repay the amount mentioned in the notice with the notice interest. The amount mentioned in the notice have not been repaid to the Bank. Therefore notice to public is hereby given to the effect that the immovable property described herein below will be sold by the Authorised officer by public auction on the date, Place and time mentioned in the notice on "AS IS WHERE IS CONDITION" persons or organization interested in buying the said immovable properties may contact the Authorised officer or

		DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES		
Name of the Borrower / Guarantor and Mortgagor	Demand Notice Date & O/s. Am. Balance+Interest	Description of the Immovable Properties	Reserve Price Rs. EMD Rs. / Bid Increments Am. Rs	
M/s. Walkal Silk	21.07.2016 Property No. 1 :- District Surat, Village- Sarthana, (1) Block No. 149, Paikee 1, Residential Non Agricultural land 12905 sq.mt. (2) Block No. 149 Paikee No. 4 Residential & Non Agricultural land		Rs. 29,00,000/-	
Mills Pvt. Ltd.,	3,15,11,198/-	12141 Sq.mt. "Rajhans Swapna" Building Indra, Flat No. 603, and 6th floor in area 1200 sq.ft. In	Rs. 2,90,000/-	
Mr. Patel Bharatbhai Virajibhai (Director), Mr.	with interest Thereon From	Builtup area 861 sq.ft. Mouje-Sarthana, Surat. (Property Holder Patel Bhavnaben B.) <b>Bounded by as</b> follows: - East: Lobby, West: Marginal Space, North: Flat No. 604, South: Marginal Space	Rs. 20,000/-	
Ghori Jupin Premjibhai (Director), Ghori Hiteshbhai	01.05.2016	Common marriage Hall.	ns. 20,000/-	
Premjibhai (Director), Mrs.	With Cost / Charges.	Property No. 2 :- District - Surat, Village - Sarthana, (1) Block No. 149, Paikee Residential Non Agriculture land 12905 Sq.mt. (2) Block No. 149 Paikee No. 4 Residential & Non Agriculture land	Rs. 29,00,000/-	
Patel Bhavnaben Bharatbhai (Director), Mrs.		12141 Sq.mt. "Rajhans Swapna" Building Indra, Flat No. 604, 6" Floor in area 1200 Sq.fts. in Builtup	Rs. 2,90,000/-	
Ghori Manisha Kiritkumar (Director), Guarantors and		Area 856 Sq.ft. Mouje- Sarthana, Surat. (Property Holder Patel Bharatbhai V.), Bounded by as follows:-East: Lobby, West: Marginal Space, North: Mitra Building, South: Flat No. 603.	Rs. 20,000/-	
Consenting Party : Mr.	Property No. 3 :- District Surat Village- Adajan, Moje Kosad, Block No. 763, Residential No. 487/1, T.P. No. 66 (Kosad-		Rs. 18,25,000/-	
Lathiya Umesh Revajibhai, Mr. Dungrani Dineshbhai	THE PLANE AND DESCRIPTION OF SHAPE OF	Variyav) F.P. No. 222, in Non-Agriculture land "Astha Residential", Sai Building No. I, 2" Floor, Flat no. 202 in Super Builtup		
Raghavbhai, and Mr. Maskar Pradip Sureshbhai,	area 1133 Sq.fts. and built up area 67.65 Sq.mts. Kosad, Surat. (Property Holder Jupin P. Ghori) <b>Bounded by as follows</b> :- <b>East</b> : Flat of J Wing, <b>West</b> : Flat No. 201, <b>North</b> : Marginal Space and H Building, <b>South</b> : Lobby, Lift & Staircase.			
Mr. Patel Bharatbhai	Property No. 4:- District - Surat, Mouje Village - Navagam, Lambe Hanuman Road, S.No. 22, T.P. No. 4, F.P. No.		Rs. 68,00,000/-	
Virajibhai Director of M/s. Padampriya Ltd.	153, Shyam Nagar Society, (Suchit) Plot No. 11/A, City survey Nondh No. 1577 in area 75.437 Sq.mt. (Property Holder Ghori Hitesh P.) Bounded by as follows: - East: Road, West: C.T.S. No. 1586, Plot No. 2/B, North: C.T.S.			
, man ipi ja ma	THE RESIDENCE OF A STATE OF THE LITTLE OF	o. 10/B, South : C.T.S. No. 1578, Plot No. 11/B.	Rs. 20,000/-	
M/s. Niddhi Creation (1). Mr. Bhavin Shantilal Chhag (Proprietor) (2) Smt. Darshanaben Bhavinbhai Chhag (Co-Applicant) Guarantor / Consenting party :- (1). Mr. Sudhir Jethabhai Mavan (2). Mr. Bipinkumar Ramjibhai Vasoya, (3). Mr. Sanjay Babubhai Hirpara	Demand Notice 21.09.2016 Outstanding amount balance Rs. 2,77,67,257/- + further interest thereon from 01.07.2016 + charges etc.	All that piece and parcel of the properties bearing Block No. 95/A in area 0-32-37 Sq.Mtrs. Plot no. 15 to 20 in area 220.54 Sq.Mtr.in constructed building known as Vedkaran Complex Ground floor Shop no.1 to 9 & Second floor Flat no.1 to 5 Near Hyundai showroom, village sayan, tal olpad, dist surat.  i. Ground floor shop no.1, in carpet area 12.45 sq.mtr. and built up area 14.96 sq.mtr.  iii. Ground floor shop no.2, in carpet area 11.80 sq.mtr. and built up area 14.22 sq.mtr.  iii. Ground floor shop no.3, in carpet area 10.50 sq.mtr. and built up area 12.64 sq.mtr.  iv. Ground floor shop no.4, in carpet area 13.48 sq.mtr. and built up area 16.17 sq.mtr.  v. Ground floor shop no.5, in carpet area 17.65 sq.mtr. and built up area 21.19 sq.mtr.  vii. Ground floor shop no.6, in carpet area 16.82 sq.mtr. and built up area 20.26 sq.mtr.  viii. Ground floor shop no.7, in carpet area 15.89 sq.mtr. and built up area 19.05 sq.mtr.  viii. Ground floor shop no.8, in carpet area 14.50 sq.mtr. and built up area 17.38 sq.mtr.  viii. Ground floor shop no.9, in carpet area 14.03 sq.mtr. and built up area 16.82 sq.mtr.  x. Second Floor Flat no.1, in built up area 415 sq.fts.  xii. Second Floor Flat no.2, in built up area 464 sq.fts.  xiii. Second Floor Flat no.4, in built up area 442 sq.fts.  xiii. Second Floor Flat no.5, in built up area 456 sq.fts.  All Above properties bounded by as per record of rights.	Rs. 1,08,00,000/- Rs. 10,80,000/- Rs. 50,000/-	
M/s. Aayan Fabrics	Demand Notice 22.04.2016 Outstanding	2.04.2016 to 20 in area 220.54 Sq.Mtr. Constructed building known as Vedkaran Complex First Floor, Shop No.		
Prop. Mr. Devendra Kantilal Dhanani,	amount balance	i. First floor shop no.1, in carpet area 21.28 sq.mtr. and built up area 25.56 sq.mtr.	Rs. 6,30,000/-	
Guarantor / Consenting party : (1). Mrs. Kinjal Sudhir Dhanani (2). Mr. Hardasbhai Bhagwanbhai Nasit, (3). Mrs. Darshanaben Bhavinbhai Chhag	Rs.  2,67,35,732/ + further interest thereon from 01.04.2016 Nasit, lanaben  ii. First floor shop no.2, in carpet area 20.16 sq.mtr. and built up area 23.98 sr. First floor shop no.4, in carpet area 9.39 sq.mtr. and built up area 11.25 sq. First floor shop no.5, in carpet area 17.65 sq.mtr. and built up area 21.19 sr. First floor shop no.6, in carpet area 16.82 sq.mtr. and built up area 20.26 sr. First floor shop no.7, in carpet area 15.89 sq.mtr. and built up area 19.05 sr. First floor shop no.7, in carpet area 6.88 sq.mtr. and built up area 27.50 sr.		Rs. 50,000/-	

All Above properties bounded by as per record of rights. Date of Inspection site: 18.05.2022 (Wednesday) between 12.00 Noon to 4.00 PM

Auction Date & Time: 27.05.2022 (Friday) at 12.00 Noon to 5.00 PM Last date of Submitting EMD: 26.05.2022 (Thursday) up to 4.00 PM

Place for obtaining and submitting EMD: The Nashik Merchant's Co. Op. Ltd., Nashik (Multi State Scheduled Bank) Shree Jay Maruti Complex, Ground Floor, Nr. Gujarat Samachar Press, Udhana Darwaja, Ring Road, Surat - 395002. (Phone No. 0261 - 2631670)

 Place of Auction: above mentioned for Auction Date & Time. at The Nashik Merchant's Co. Op. Ltd., Nashik (Multi State Scheduled Bank) Shree Jay Maruti Complex, Ground Floor, Nr. Gujarat Samachar Press, Udhana Darwaja, Ring Road, Surat - 395002. (Phone No. 0261 - 2631670)

Third Floor Flat no.1, in built up area 415 sq.fts. Third Floor Flat no.2, in built up area 668 sq.fts. Third Floor Flat no.3, in built up area 464 sq.fts. Third Floor Flat no.4, in built up area 442 sq.fts. Third Floor Flat no.5, in built up area 456 sq.fts.

TERMS AND CONDITIONS :-

1. Interested parties may send / submit their property wise separate offer for purchasing the said properties in sealed cover super scribed as "Offer for purchases .. along with 10% of offer price as earnest money which is refundable if offer is not successful.

First floor shop no.9, in carpet area 14.50 sq.mtr. and built up area 17.38 sq.mtr. First floor shop no.10, in carpet area 14.03 sq.mtr. and built up area 16.82 sq.mtr.

The Authorized officer reserves all the rights to reject the Auction and / or adjourn / or postpone the date and time of Auction or Sale Confirmation without giving any

That the Bank has obtained Physical Possession.

The highest Bidder will have to Pay 1% T.D.S. above the payment of Rs. 50.00 Lacs (as per app.) Mortgagor / Borrower / Co - Borrower / Guarantor may bring prospective bidders and may also remain present at the time of Auction.

Proof of Identification / Address Proof (KYC) viz. Self attested copy of Voter ID Card / Driving License / Passport / Ration Card etc. The successful offer shall pay initial deposit being 25% (10% earnest money and 15% additional amount) of the offer amount immediately on the being confirmed in his favour and the balance amount within 15 days from date of auction. If the successful bidder fails to pay the balance 75% of the bid amount within 15 days from date of

Please note that the Demand Draft / Pay order be accepted as EMD amount. Before the Last Date & Time of submission of the Bid Documents vix (i). Copy of PAN, (ii)

auction the deposited amount (EMD and 15% of Offer amount) will be forfeited and the property will be kept for sale again. Legal Charges for Transfer, Conveyance, Stamp duty, Registration charges with Registrar, Municipal Taxes, Building Maintenance, Electricity Charges, Water charges and any other charges applicable if any shall be borne by purchaser and the should complete all transfer formalities applicable to transfer of property. In every

case the decision of the Authorized Officer is final. 9. The intending bidders can inspect the property between above mentioned date & Time. For further details / queries contact : Mr. K. R. Shiledar (Authorised Officer)

(M): 9822313537, Tushar Khairnar (M): 7276809997 & Udhna Branch: Kamlesh Bhatt (M): 9978972767 OR Zenith Recovery Agency: Sanjay Nayak (M): 9824277792.

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER RULE 8(6) OF THE SARFAESI ACT - 2002 The Borrower / Guarantors are hereby noticed to pay the sums mentioned as above before the date of Auction, falling which the property will be auctioned and balance if any will be

recovered with interest and cost from them by legal avenue.

The Nasik Merchants' Co-Op. Bank Ltd., Nashik Date: 07.05.2022 ( Multi-State Scheduled Bank) Place : Surat

/ 🎎 बैंक ऑफ़ बड़ौदा बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda 🛮 E-AUCTION — SALE NOTICE Bank of Baroda Bank of Baroda, Regional Office, Banaskantha Region,

Aroma Circle, Palanpur, 385001

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES "APPENDIX- IV-A [See proviso to Rule 6 (2) & 8 (6)]

E-Auction Sale Notice for Sale of Movable & Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6(2) and 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor (s) that the below described movable properties mortgaged/charged to Bank of Baroda, the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is and without recourse basis" on 17th June, 2022 for recovery of below mentioned account/s. The details of Borrower/s/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/e-Auction date & Time, EMD and Bid Increase Amount are mentioned below -

Name & address of Description of property to be sold Reserve Price, EMD and Bid Status of Possession Increase Amount. (Constructive/Physical) with Known encumbrances Borrower/s /Guarantor/s 1) M/s Saraswati Sand Product (Borrower Partnership Firm) C/o Prem Motors, Hello point Hotel, Abu road | Equitable mortgage of Commercial Plot at R.S. No. | Rs. 19,70,121.78 and interest Reserve Price: Physical Highway, Palanpur, Dist Banaskantha-385001 253+267/1, 267/2+268p2 (N.A. land for thereon from 30.10.2021 & Rs.1,36,12,500/-Also at:- M/S Saraswati Sand Product, Vayad, R.S. No 55, paiki 1, Taluka: Saraswati, District Patan, North | commercial purpose), Plot No. 15 to 23, situated in | Legal expenses EMD: Rs.13,62,000/-Gujarat (2) Mr. Moghjibhai Daljibhai Patel (Partner cum Gurantor) residing at Bera vas, Opposite the sim of Palanpur, Northern side of Ahmedabad Bid Inc.: Rs.25,000/-Dairy, Ambaliyal, Vasan, Palanpur Dist Banaskantha-385001 (3) Mr. Rameshkumar Nanjibhai Patel (Partner Delhi State Highway road, Taluka: Palanpur, cum Gurantor) residing at Patel vas, Vagda, Dist Banaskantha-385001 (4) Mr. Mahendrakumar Amratlal District: Banaskantha total admeasuring 4321.00 Patel (Partner cum Gurantor) residing at Patel bhuvan, Becharpura, Palanpur Dist Banaskantha-385001 (5) Mr. Premjibhai Nanjibhai Patel (Gurantor) residing at Patelvas, Vagda, Palanpur, Dist Banaskantha-385001

Date & Time of E-auction - Date: 17-06-2022 Auction Time: 02:00 PM to 06:00 PM

Property Inspection date & Time- 26-05-2022 between 01:00 PM to 3:00 PM or By Taking Prior Appointment

3rd Floor, Rudra Arcade, Deesa Highway Road,

Name of Authorised officer- Himmat Singh Gehlot (Chief Manager) 8279224816, Harmanpreet Singh (Manager) 7984679806.

For detailed terms and conditions of sale, please refer to the link provided in https://www.bankofbaroda.in/e-auction.htm and https://ibapi.in. Also, prospective bidders may contact respective Authorized Officer. The auction sale will be online e-auction / Bidding through website https://www.mstcecommerce.com on date and time mentioned above with unlimited extension of 10 minute duration each.

# STATUTORY 30 DAYS SALE NOTICE UNDER SARFAESI ACT TO BORROWER/GUARANTOR/MORTGAGOR

The above mentioned borrower /s is/ are hereby noticed to pay the sum as mentioned in section 13(2) Notice in full before the date of auction, failing which property will be auctioned / sold and balance dues if any will be recovered with Interest and cost from borrowers/ guarantors/mortgagor.

Date: 07.05.2022

Bank of Baroda, Banaskantha Region

Authorized Officer/ Chief Manager,



## તમારા સવાલોઃ ધિરાણો

# ધિરાણ તબદીલીની કવાયત કરી શકો

મારે આવાસ ધિરાણ પર હજી આઠ વર્ષ માટે ઇએમઆઇની –નવીન જહા

શકો. તમારી પાસે અહીંયા બે વિકલ્પો ઉપલબ્ધ છે. એક તો તમારી વાસ્તવમાં દીકરાને તબદીલ થશે. શકાય.

ચોક્કસ બીજો વિકલ્પ તમારા કુટુંબમાં ધારાધોરણોનું પાલન થાય તો ટોપ- કરી શકો.

પરસ્પર સમજૂતી હોય અને તમારો અપ લોન મંજૂર થઇ જશે. તમારો દીકરો તમારા ખાતામાં ઇએમઆઇ પહેલો જે સવાલ છે તેનો જવાબ તબદીલ કરે. માસિક ધોરણે તે એવો છે કે, જ્યાં સુધી સંબધીત ઇએમઆઇ તબદીલ કરતો રહે તો મિલ્કતની માલિકી તમને તબદીલ ચુકવણી કરવાની રહેશે. હું આ વર્ષે આ સંજોગોમાં તમારી લોન ચાલુ ના થાય ત્યાં સુધી ધિરાણ તમારા નિવૃત થઇ રહ્યો છું તો આ સંજોગોમાં રાખી શકાય. મારા પીતાશ્રી મને નામે તબદીલ ના થઇ શકે. તમારા મારૂ ધિરાણ મારા દીકરાના નામે આવાસ ધિરાણ તબદીલ કરી શકો પીતાશ્રી માટે એક વિકલ્પ એવો રહે તબદીલ કરી શકું જેથી કરીને તે અને એક બેંકમાંથી બીજી બેંકમાં છે કે, ગીફ્ટ ડીડથી મિલ્કત તમને ઇએમઆઇની ચુકવણી કરી શકે ? તબદીલ થાય. જેથી કરીને આ જ તબદીલ કરે અને તેની સાથે તમે મિલ્કત પર ટોપ–અપ લોન મળી તમારા નામે આવાસ ધિરાણ માટે અસ્ક્યામત તમારા નામે હોય શકે. ટોપ-અપની જે રકમ છે તેમાં અરજી કરો. બીજો વિકલ્પ છે જેમાં તો તમે ધિરાણ તબદીલ ના કરી વેરા મુક્તિનો લાભ મળશે ? મિલ્કત અને ધિરાણ પીતાના નામે **-રવાલી યારલગડ્ડા** રહેશે અને તેમને રોકડના મોરચે તમારા પીતાશ્રી બીજી બેંકમાં સરળતા રહે તે માટે દર મહિને તમે અસ્ક્યામત દીકરાના નામે તબદીલ આવાસ ધિરાણ તબદીલ કરી શકે નિયત ૨કમ તેમના ખાતામાં કરો અને તેતેના નામે ધિરાણ મેળવે. અને તેમ કરતી વખતે જ ટોપ–અપ તબદીલ કરતા રહો. આ કિસ્સામાં તેનાથી તમારી જે જવાબદારી છે તે લોન માટે નવી બેંકમાં અરજી કરી તમે કલમ ૮૦ સી કે ૨૪ બી હેઠળ કરેલા કોઇ વેરા લાભ માટેનો દાવો નહીં

# તમે અસ્ક્યામત તબદીલ કર્યા પછા જ કેન્દ્રના પ્રધાને આરસીએફની બે નવી પ્રોડક્ટ લોન્ય કરી

પીટીઆઇ

નવી દિલ્હી. તા. ૮

કેમિકલ્સ રાજ્ય કક્ષાના પ્રધાન ભગવંથ નિવેદનમાં જણાવ્યું હતું. કુબાએ આજે સરકાર સંચાલિત રાષ્ટ્રીય કેમિકલ્સ સમતુલિત ખાતર છે અને તે લિમિટેડ(આરસીએફ)ની બે તમામ પ્રકારની જમીન માટે નવી પ્રોડક્ટસ લોન્ચ કરી યોગ્ય છે. હતી. આમાં એનપીકે આરસીએફની રિસર્ચ એન્ડ બનાવે છે. ડેવલપમેન્ટ યુનિટ દ્વારા વિકસાવવામાં

અને ચેમ્બર-મુંબઇ ખાતે ખુક્ષી ફર્ટિલાઇઝર્સ ખાતાના કેન્દ્રના મૂકી હતી, તેમ સત્તાવાર <u>૩૦ ટકા અને ચોખામાં ૨૧ વધારે છે. તેની ૨૫૦ છે.</u>

> સુફલા ૧૦ઃ૨૬ઃ૨૬ એ કર્ટિલાઇઝર તમામ પ્રકારના પાક અને

ફોસ્ફરસ ખાતરના નવા ગ્રેડની પોટેશિયમ ધરાવે છે, જે ''સુફલા ૧૦ઃ૨૬ઃ૨૬'' જે એનપીકે ખાતરોમાં સૌથી તમામ પાક અને તમામ વધુ રેશિયોમાંનું એક છે. પ્રકારની જમીન માટે યોગ્ય સુફલા મૂળનો વૃદ્ધિ દર અને ''વિપુલા વિકાસ વધારે છે. અને ૧૦:૧૦:૧૦'' છે, જેને પ્લાન્ટનો વિગર મહત્તમ

> વિપુલાના આવી લિક્વિડ કોન્સન્ટ્રેટ ફોર્મ વધારે સારી પ્રાપ્યતા અને

PREMIER SYNTHETICS LIMITED Reg. Office: Surana House, Behind Klassic Chambers, Swastik XRd, Opp. Narnaraya

Complex, Navrangpura, Ahmedabad-380009, Gujarat Notice

The Meeting of the Board of Directors of th Company will be held on Thursday, 19 May, 2022 at 03:00 P.M. at the registered office of the Company at Surana House, Behind Klassic Chambers, Swastik X Rd, Opp Narnarayan Complex, Navrangpura Ahmedabad- 380009, inter alia, to consider Quarter and Financial Year ended 31 s March, 2022, to consider dividend on the Non-convertible Non-cumulative redeemable preference shares and to transact othe ousiness with the permission of chairman. For http://www.premiersyntheticsltd.com/ & https://www.bseindia.com/stock-share price/premier-synthetics-

For, Premier Synthetics Limite Date: 07/05/2022 Vismay Makwan Place: Ahmedabad Company Secretary

પ્રધાને આવી પ્રોડક્ટસ પ્લાન્ટસદ્વારાન્યૂટ્રિઅન્ટસના ટકા સુધી ઉપજનો વધારો એમએલના એક બોટલનો આરસીએફ ટ્રોમ્બે યુનિટ વપરાશની ખાતરી આપે છે. મેળવવામાં મદદ કર છે. તે ભાવરૂપિયા ૨૫૦ છે, જે એક આનો ઉપયોગ ઘઉંમાં પાક ઉપજની શેલ્ફ લાઇફ એકર જમીન માટે પૂરતું

> ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કંપની લીમીટેડ Chola અમદાવાદ શાખા : ૪૦૭-૪૦૮, ચોથો માળ, યશ એકવા બિલ્ડીંગ,

Enter a better life મેક ડોનાલ્ડ્સની ઉપર, વિજય ક્રોસ રોડ, નવરગપુરા, અમદાવાદ-૩૮૦૦૦ સ્થાવર મિલકત માટે (નિયમ - ૮(૧))

આથી નીચે સહી કરનાર મે. ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કંપની લીમીટેડ, જેની રજીસ્ટર્ડ ઓફિસ, પહેલો માળ, ડેર હાઉસ, નં. ૨, એનએસસી બોઝ રોડ, ચેજ્ઞાઇ - ૬૦૦૦૦૧ અને ૪૦૯ - ૪૦૮, ચોથો માળ, ચશ એકવા ભિલ્હીંગ, મેક કોનાલ્સના કિપર, વિજય ક્રોસ રોક, નવરંગપુર, અમદાવાદ - ૩૮૦૦૦૬ ના અધિકૃત અધિકારીથ્રીએ સિક્સોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓક કાયનાત્રીયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ ઓફ સિક્સોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને સિક્સોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ - ૨૦૦૨ ના નિયમ વેચાણે લેવાની ક્લમ ન ૩(૧૩) અંતર્ગત તારીખ ૧૨.૦૨.૨૦૨૨ ના રોજ લોન એકાઉન્ટ નં. XOHEAHM00002066631 and HE02AHM0000007646 ને ડિમાન્ડ નોટીસ ઉધારકર્તા અને સહ-ઉધારકર્તાઓ (૧). ભરતકુમાર બાબુભાઇ દેસાઇ, (૨). હૈતલબેલ ભરતભાઇ દેસાઇ, (૩). બાબુભાઇ લાગછુભાઇ દેસાઇ, (૪). ચામુંકા કેરી ની બાકી હહેણા ની રકમ જ્ઞા. વર, ૦૦,૦૦% -(૩). એકવીસ લાખ સાત હજાર ઓગારાસ્ટ્રાસ પ્રગુ) તથા તા. ૦૫.૦૨.૨૦૨૨ ના રોજ થી વ્યાજ સાથે નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ભરી જવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

ા નામાના આ ત્યાના કાર્યો કુકવવામાં કસુરવાર થતાં આવી ઉધારકર્તાઓ તથા જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કેસિકયોરીટી ઈન્ટરેસ્ટ (એન્કોસંમેન્ટ) રૂલ્સ - ૨૦૦૨ની અધિનિયમની કલમ ૧૩(૪), ૧૩(૧૨) તથા ઉક્ત નિયમો હેઠળના નિયમ બેનર્ગત મળેલ સત્તાની રૂએ અધોહસ્તાક્ષરકર્તાએ **તા. ૦૬.૦૫.૨૦૨૨** ના રોજ નિમ્નલિયિત મિલકતોનો કબજો લઇ લીધો છે.

ઉધારકર્તાઓનું ધ્યાન સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈઓ પ્રત્યે દોરવામાં આવે છે. વેચાણ

વહલા 30 વત લવન એ જલ્લા, કાર્ય, અલ્લાન ભારત ભારતાના સામાન્ય પણે આવી કારણું મિલકતી એંગે કોઈપણ જાતની વ્યવહાર -ઉધારકતીને વિશેષ રૂપથી તથે જાહેર જનતાને સામાન્ય પણે આવી કારણું મિલકતી એંગે કોઈપણ જાતની વ્યવહાર કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકતી એંગે કરેલો કોઈપણ વ્યવહાર **મે. હોલામંકલમ ઇન્વેસ્ટમેન્ડ** એન્ડ ફાયઆન્સ કંપની લીમીટેડ ની ભાકી ૨૩મ રૂા. ૨૧,૦૦,૦૪૯/- (રૂા. એક્લીસ લાખ સાત **૯**જાર ઓગણપ્ટ્યાસ પુરા) તથા ૦૫.૦૨. ૨૦૨૨ ના લીમીટેડ ની ભાકી ૨૩મ રૂા. ૨૧,૦૦,૦૫ના બોજાને સહિત રહેશે. સ્થાવર મિલ્કતનું વર્ણન

મિલકતનો ફલેટ નં. સી/૧૦૩, પહેલો માળ, બ્લોક નં. સી, ''સત્યેશ રેસીડેન્સી'', જેનું સુપર બિલ્ટ આશરે ક્ષેત્રફળ દ્ સ્કે.મી., એકત્રીકરણ કરેલ સર્વે નં. ૧૧૧ પૈકી (જુનો બ્લોક નં. ૧૩૦, ૧૩૧ અને ૧૩૨), મોજે ગ્રામ - સનાથલ, તાલુકો સાણંદ, રજીસ્ટ્રેસન જીલ્લો - અમદાવાદ અને સંબ જીલ્લો - સાણંદ. **ચતુઃસીમા ઃ- પૂર્વે** : ખુલ્લી જગ્યા, પશ્ચિમે : કોમન પેસેજ, **ઉત્તરે**: ખુલ્લી જગ્યા, **દક્ષિણે** : ફલેટ નં. સી/૧૦૪. સહી/-, અધિકૃત અધિકારી

નોંધ :( વિવાદ ની સ્થિતીમાં અંગ્રેજી આવૃતિને માન્ય રાખવામાં આવશે)

## RAMSARUP INDUSTRIES LTD.

CIN: L65993WB1979PLC032113 Read, Office: "Hasting Chambers", 7C, Kiran Shankar Roy Road, 2nd Floor, Room No.1, Kolkata-700 001 Telephone nos. 033-40009100/22421200, Fax – 91-33-2242-1888 Website: www.ramsarup.com Email: company@ramsarup.com

#### NOTICE OF ANNOUNCEMENT OF RESULTS OF E-VOTING AT THE 39TH ANNUAL GENERAL MEETING OF THE COMPANY

In terms of Section 108 110 and other applicable provisions of the Companies Act, 2013 as amended, read together with the Companies (Management and Administration) Rules. 2014, and in compliance with applicable regulation of SEBI LODR regulation, 2015 as amended from time to time, approval of the members was sought by means of remote evoting/e-voting at the AGM. The Company had provided remote e-voting facility to the members to cast their votes on Ordinary Resolution proposed in the Notice calling Annual General meeting dated April 12, 2022.

The Monitoring Agency had appointed M/s Sachin Pilania & Associates, Company Secretaries in Practice as the scrutinizer of the e-voting process in the Annual genera

The Scrutinizer has carried out the scrutiny of all electronic votes received up the last date i.e, May 4, 2022 at 5:00 PM and e-voting done at the AGM of the company.

Based on Scrutinizer's report dated May 6, 2022, the Company declared the results of e

SI No.	Particulars	% of total valid votes cast in favour of the resolution
1.	Ordinary Resolution for adoption of Audited Standalone Financial Statements of the Company for the financial year ended March 31, 2018 together with the Reports of the Board of Directors and Auditors	100
2.	Ordinary Resolution for Appointment of M/S Ray & Co, Chartered Accountants, Kolkata as Statutory Auditors to hold office, for four years, from the conclusion of the 39th Annual General Meeting (Present meeting) till the conclusion of the 43rd Annual General Meeting of the Company	100

Based on the above report of the scrutinizer, the resolutions as set out in the Notice calling Annual general meeting are deemed to have been duly approved by the members with requisite majority on Thursday, May 5, 2022, being the date of Annual general meeting The results along with Scrutinizers report are available at the registered office of the company. The same is also available at the website of the company at www.ramsarup.com and the same is also available at the website of NSE and BSE.

For RAMSARUP INDUSTRIES LIMITED Place: Kolkata Vikash Rungta Dated: 7th May, 2022 (Director)

ઇન્સોલ્વેન્સી અને બેંકરપ્ટસી કોડ, ૨૦૧૬

હેઠળ વેચાણ નોટીસ

જેવીએલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લી<u>મીટે</u>ડ (ફડચામાં)

CIN-L15140UP 1989PLC011396 રજીસ્ટર્ડ ઓફીસ: એસ ૨/૬૩૯–૧૮, હશ્મી કોમ્પલેક્ષ, જે પી મેહતા ઇન્ટર કોલેજપાસે, કલ્બ રોડ,

વારાણસી–૨૨૧ ૦૦૨. ઉત્તર પ્રદેશ, ભારત.

ફડચા પ્રક્રિયા હેઠળની કંપની)

ફડચા અધિકારીની ઓફિસ: સી/ઓ, બીડીઓ ઇન્ડિયા એલએલપી, ચોથો માળ, ડકબેક હાઉસ, ૪૧ શેક્સપીચર સારણી, કલકત્તા- ૭૦૦ ૦૧૭, ભારત.

જેવીએલ એગ્રો ઇન્ડસ્ટીજ લીમીટેડ (જેવીએલ અથવા કોર્પોરેટ દેવાદાર) માનનીય નેશલ કંપની લો ટીબ્યનલ

ાલ્હાબાદ બેન્ચના તારીખ ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ ના આદેશ હેઠળ ઇન્સોલ્વેન્સી અને બેંક્રય્ટસી કોડ, રેંગ્વર્

(આઇબીસી) ની જોગવાઇઓ મુજબ હાલમાં કડચા પ્રક્રિયા હેઠળ છે અને શ્રી સુપ્રિયો ફમાર ચૌધરીને તેના કડચ

આર્થી આઇબીસી અને તે હેઠળ રચાચેલ નિચમો અને આઇબીબીઆઇ (લિક્લીડેશન પ્રક્રિયા) નિચમનો, ૨૦૧૬

ના નિયમન ૩૧એ હેઠળ સ્થાયેલ સ્ટેક્ફોલ્ડરોની સલાહકાર સમિતિની ૨ મે, ૨૦૨૨ ના રોજ યોજાયેલ તેની બેઠકમાં અપાયેલ સલાહ અને સુચનો અન્વયે ઇ–હરાજી પ્રક્રિયા માહીતી દસ્તાવેજો માં જણાવેલ શરતો અને

નિચમો મુજબ જે www.jvlagro.com ઉપર જોઇ શકાશે મુજબ જ્યાં છે, જે છે અને જેમ છે ના ધોરણે અને કોઇ આશ્રય વિના કોર્પોરેટ દેવાદારની એસેટોના નીચે જણાવેલ અલાયદા બ્લોકની ખરીદી માટે ઇ–હરાજી (૩૧ મે,

૦૦૨૨ ના રોજ બધોરે ૨.૦૦ અને સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન ) માં ભાગ લેવા માટે ભાવી ઇચ્છક બીડરો પાસેર્થ

કળાભાઇના ભાનગલ માટે બન પાંડ ભાવનકાન કુમાં માં પમાં કરવા માટે ભારાત ભાવામાં ભાવ છે. ઇ-હરાજુ સર્વિસ પ્રદાતા, મેસર્સ ઇ-પોક્સુરમેન્ટ ટેકનોલીજીસ લીમીટેક (એક્સન ટાઇગર) વેબસાઇટ https://ncltauctiontiger.net મારફત નીચે જણાવેલ વિગતો અનુસાર હાથ ધરાશે.

ઇના આમંત્રણ માટે અને બીડ એપ્લિકેશન ફોર્મ માં જેમા કરવા માટે નોટીસ આપવામાં આવે છે. ઈ-

. અધિકારી તરીકે નિમારોલ છે

ાસીએલટી, અલ્હાબાદ બેન્ચ દ્વારા પાસ કરાચેલ આદેશ તારીખ ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ અંતર્ગત

### RAMSARUP INDUSTRIES LTD.

છે.

CIN: L65993WB1979PLC032113 Regd. Office: "Hasting Chambers",7C, Kiran Shankar Roy Road, 2nd Floor, Room No.1, Kolkata-700 001 Telephone nos. 033-40009100/22421200, Fax - 91-33-2242-1888 Website: www.ramsarup.com Email: company@ramsarup.com

#### NOTICE OF ANNOUNCEMENT OF RESULTS OF E-VOTING AT THE 42<sup>nd</sup> ANNUAL GENERAL MEETING OF THE COMPANY

In terms of Section 108,110 and other applicable provisions of the Companies Act, 2013 as amended, read together with the Companies (Management and Administration) Rules, 2014, and in compliance with applicable regulation of SEBI LODR regulation, 2015 as amended from time to time, approval of the members was sought by means of remote evoting/e-voting at the AGM. The Company had provided remote e-voting facility to the members to cast their votes on Ordinary Resolution proposed in the Notice calling Annual General meeting dated April 12, 2022.

The Monitoring Agency had appointed M/s Sachin Pilania & Associates, Company Secretaries in Practice as the scrutinizer of the e-voting process in the Annual general

The Scrutinizer has carried out the scrutiny of all electronic votes received up the last date i.e. May 4, 2022 at 5:00 PM and e-voting done at the AGM of the company.

Based on Scrutinizer's report dated May 6, 2022, the Company declared the results of evoting as under:

SI No.	Particulars	% of total valid votes cast in favour of the resolution
1.	Ordinary Resolution for adoption of Audited Standalone Financial Statements of the Company for the financial year ended March 31, 2021 together with the Reports of the Board of Directors and Auditors	100

Based on the above report of the scrutinizer, the resolutions as set out in the Notice calling Annual general meeting are deemed to have been duly approved by the members with requisite majority on Thursday, May 5, 2022, being the date of Annual general meeting The results along with Scrutinizers report are available at the registered office of the company. The same is also available at the website of the company at www.ramsarup.com and the same is also available at the website of NSE and BSE

For RAMSARUP INDUSTRIES LIMITED Vikash Rungta Place: Kolkata Dated: 7th May, 2022 (Director)

## RAMSARUP INDUSTRIES LTD.

CIN: L65993WB1979PLC032113 Regd. Office: "Hasting Chambers",7C, Kiran Shankar Roy Road, 2nd Floor, Room No.1, Kolkata- 700 001 Telephone nos. 033-40009100/22421200, Fax – 91-33-2242-1888 Website: www.ramsarup.com Email: company@ramsarup.com

#### NOTICE OF ANNOUNCEMENT OF RESULTS OF E-VOTING AT THE 40th ANNUAL GENERAL MEETING OF THE COMPANY

n terms of Section 108,110 and other applicable provisions of the Companies Act, 2013 as amended, read together with the Companies (Management and Administration) Rules, 2014, and in compliance with applicable regulation of SEBI LODR regulation, 2015 as amended from time to time, approval of the members was sought by means of remote e voting/e-voting at the AGM. The Company had provided remote e-voting facility to the members to cast their votes on Ordinary Resolution proposed in the Notice calling Annua General meeting dated April 12, 2022.

The Monitoring Agency had appointed M/s Sachin Pilania & Associates, Company Secretaries in Practice as the scrutinizer of the e-voting process in the Annual genera

The Scrutinizer has carried out the scrutiny of all electronic votes received up the last date i.e, May 4, 2022 at 5:00 PM and e-voting done at the AGM of the company. Based on Scrutinizer's report dated May 6, 2022, the Company declared the results of e

voting as under **Particulars** % of total valid votes cast

No.	T di dodiaio	in favour of the resolution			
1.	Ordinary Resolution for adoption of Audited Standalone Financial Statements of the Company for the financial year ended March 31, 2019 together with the Reports of the Board of Directors and Auditors	100			
Based on the above report of the scrutinizer, the resolutions as set out in the Notice calling					

Annual general meeting are deemed to have been duly approved by the members with requisite majority on Thursday, May 5, 2022, being the date of Annual general meeting The results along with Scrutinizers report are available at the registered office of the company. The same is also available at the website of the company at www.ramsarup.com and the same is also available at the website of NSE and BSE.

For RAMSARUP INDUSTRIES LIMITED Place: Kolkata Vikash Rungt Dated: 7th May, 2022 (Director



### RAMSARUP INDUSTRIES LTD.

CIN: L65993WB1979PLC032113 Regd. Office: "Hasting Chambers",7C, Kiran Shankar Roy Road, 2nd Floor, Room No.1, Kolkata- 700 001 Telephone nos. 033-40009100/22421200. Fax – 91-33-2242-1888 Website: www.ramsarup.com Email: company@ramsarup.com

#### NOTICE OF ANNOUNCEMENT OF RESULTS OF E-VOTING AT THE 41st ANNUAL GENERAL MEETING OF THE COMPANY

In terms of Section 108 110 and other applicable provisions of the Companies Act. 2013 as amended, read together with the Companies (Management and Administration) Rules 2014, and in compliance with applicable regulation of SEBI LODR regulation. 2015 as amended from time to time, approval of the members was sought by means of remote e voting/e-voting at the AGM. The Company had provided remote e-voting facility to the members to cast their votes on Ordinary Resolution proposed in the Notice calling Annual General meeting dated April 12, 2022.

The Monitoring Agency had appointed M/s Sachin Pilania & Associates, Company Secretaries in Practice as the scrutinizer of the e-voting process in the Annual general

The Scrutinizer has carried out the scrutiny of all electronic votes received up the last date i.e, May 4, 2022 at 5:00 PM and e-voting done at the AGM of the company.

Based on Scrutinizer's report dated May 6, 2022, the Company declared the results of

SI No.	Particulars	% of total valid votes cast in favour of the resolution
1.	Ordinary Resolution for adoption of Audited Standalone Financial Statements of the Company for the financial year ended March 31, 2020 together with the Reports of the Board of Directors and Auditors	100

Based on the above report of the scrutinizer, the resolutions as set out in the Notice calling Annual general meeting are deemed to have been duly approved by the members with requisite majority on Thursday, May 5, 2022, being the date of Annual general meeting The results along with Scrutinizers report are available at the registered office of th company. The same is also available at the website of the company at www.ramsarup.com and the same is also available at the website of NSE and BSE

For RAMSARUP INDUSTRIES LIMITED Place: Kolkata Vikash Rungta

Dated: 7th May, 2022

## SHANTHI GEARS LIMITED CIN: L29130TZ1972PLC000649

Read. Office: 304-A, Trichy Road, Singanallur, Coimbatore-641005, Tamil Nadu.Tel: +91-422-4545745 Fax: +91-422-4545700 Email: cs@shanthigears.murugappa.com, Website: www.shanthigears.com **Extract of Financial Results for the Quarter and Year ended 31 March 2022** 

					₹ Crores
SI No	PARTICULARS	Quarter ended 31.03.2022	Quarter ended 31.03.2021	Year ended 31.03.2022	Year ended 31.03.2021
1	Total income from operations	105.92	74.74	346.12	223.81
2	Profit for the period before tax	18.66	12.25	58.73	26.07
3	Profit for the period/year after tax	12.22	9.42	42.47	20.17
4	Total Comprehensive Income for the period	11.84	9.26	42.01	20.01
5	Equity share capital	7.67	7.67	7.67	7.67
6	Reserves (Other Equity)			252.29	229.46
7	Earnings Per Share (in ₹)				
	Basic:	1.59	1.23	5.54	2.63
	Diluted:	1.59	1.23	5.54	2.63

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Results are available on the Stock exchange websites www.bseindia.com, www.nseindia.com and on the Company's website www.shanthigears.com

For Shanthi Gears Limited M Karunakaran Place : Coimbatore Whole-time Director Date : 07 May 2022 DIN: 09004843

### **AYM SYNTEX LIMITED** CIN: L99999DN1983PLC000045

Regd Off: Survey No. 374/1/1, Saily, Silvassa-396230 (U. T. of Dadra & Nagar Haveli) Tel: + 91-22-61637000/61637001 Fax: +91-22-24937725: Fmail id: complianceofficer@aymgroup.com

EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2022 QUARTER ENDED YEAR ENDED PARTICULARS 31.03.2022 31.12.2021 31.03.2021 31.03.2022 31.03.2021 (Unaudited) (Audited) Total income from operations (net) 40,095 Net Profit / (Loss) for the period 2.457 7.957 (before Tax, Exceptional and/or Extraordinary items#) 2.206 2.243 1.738 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items# 2,206 2,243 2,457 7,957 1,738 Net Profit / (Loss) for the period after tax 1,397 1,437 (after Exceptional and/or Extraordinary items#) 1,878 5,081 1,409 Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] 1,396 1,442 5,094 1,380 1,802 Paid up equity capital (Face value of Rs. 10 each) 5,015 5,015 5,004 5.015 5.004 Reserves (excluding Revaluation Reserve) 35.982 30.762 Earnings Per Share (before extraordinary items) (of Rs 10/- each) 2.79 2.86 3 66 10.14 2.82 Diluted 2.82 3.65 10.01 2.81

Notes:The above is the extract of the detailed format of Quarter/ Year ended Financial results filed with the Stock exchanges unde Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Regulation, 2015, The full format of the Quarter Year ended Financial results are available on the BSE website (www.bseindia.com), NSE website (www.nseindia.com) and or

the Company's website(www.aymsyntex.com) - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules / AS Rules, whichever is applicable.

For and on behalf of Board of Directors

Abhishek Mandaw Managing Director & CEO DIN: 00737785

#### ઇએમડી ઇ–હરાજી (રૂા.કરોડમાં) દરમિયાન (રીઝર્વ કિંમતના ૧૦%) (३ι. અમરેલી, ગુજરાતમાં ફ્રીહોલ્ડ જમીન પ્લોટ નં. ૧ થી ૫૭, મોજે રામપરા–૨, ગામ રાજુલા, જિલો અમરેલીના પિપાવાવ પોર્ટ પાસેની ફ્રીહોલ્ડ જમીન. 1.42 0.14 0.02 ક્ષેત્રફળ અંદાજીત ૭.૫૫ એક્ટ

નેક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઇ) તેમજ અરજી અને સંબંધિત દસ્તાવોજો જમા કરવાની છેર્લ તારીખ: ૨૪ મે, ૨૦૨૨ અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઇએણડી) જમા કરવાની છેલી તારીખ: ૨૬ મે, ૨૦૦૨,

ઇ-હરાજીની તારીખ: ૩૧ મે, ૨૦૨૨ (બપોરે ૨.૦૦ વાગ્યા થી સાંજે ૫.૦૦ વાગ્યા દરમિયાન) ટસ ધરાવતી વ્યક્તિઓ દ્વારા નિરિક્ષણની તારીખ, જો જરૂર જણાય તો: ૨૫ મે, ૨૦૨૨

ઈ–હરાજાની મુખ્ય શરતો અને નિયમો નીચે મુજબ છે:–

છો) વેચાણ ઇન્સોલ્વેન્સી અને બેંક્રય્ટસી કોંડ, ૨૦૧૬ તેમજ તે હેઠળ રચાયેલ નિયમોની જોગવાઇઓ અ આઇબીબીઆઇ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા મુજબ માનનીય એનસીએલટી, માનનીય એનસીએલએટી ારતની માનનીય હાઇકોર્ટ, માનનીય સુપ્રિમ કોર્ટ દ્વારા જારી કરાયેલ આદેશોને આધિન છે. રસ ધરાવતી વ્યક્તિઓએ ઇ-હરાજી પ્રક્રિયા માહીતી દસ્તાવેજ અને અન્ય સંબંધિત માહિતી તેમજ ઈ-હરાજીમાં ભાગ લેવા માટે જરૂરી સુચનાઓ માટે જેવીએલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની વેબસાઇટ એટલે કે https://www.jvlagro.co નિયમિત રીતે જોવી જોઇએ અથવા liquidatorivl@lgivl.com પર ઇ–મેઇલ કરવો. ઇ–હરાજ઼ પ્રક્રિયા માહીતી સ્તાવેજોની તમામ શરતો અને નિયમો તેમજ તેમાં જણાવેલ તમામ સુધારા, વધારા અને સ્પષ્ટતાઓ આ વેચાણ નોટીસમાં જણાવેલ છે. કોઇપણ અન્ય માહીતી માટે, કડ્યા અધિકારીનો +૯૧૮૬૯૭૭ ૪૯૬૦૮ અથવા + ૯૧ ૯૭૯૮૯ ૧૯૯૩૨ પર સંપર્ક કરવા વિનંતી છે.

બી) સ્પષ્ટ કરવાનું કે આ ઓકર દસ્તાવેજ નથી સી) ઇ–હરાજી જ્યાં છે, જે છે અને જેમ છે ના ધોરણે કોઇ આશ્રય વિના યોજાશે. આ વેચાણ ફડ્યા અધિકાર્ટ તરપથી કોઇપણ પ્રકારની વોરંટી અને વડતર વગરની રહેશે.

ડી) ઇ–હરાજી પ્લેટફોર્મની વિગતો: https://ncltauctiontiger.ne ઇ) રસ ધરાવતી વ્યક્તિઓને નિયત નમુનામાં તેમની ઇઓઆઇ, અરજ઼, એકીડેવીટ, અંડરટેકીંગ વગેરે r લેક્ટ્રોનીકલી અને સ્પીડ પોસ્ટ મારફત હાર્ડકોપી દ્વારા જમા કરવા વિનંતી છે. આ સબંધમાં ઇ–હરાજી પ્રક્રિયા ને લગતી વિગતવાર શરતો અને નિચમો જમાવતા ઈ–હરાજી પ્રક્રિયા માહીતી દસ્તાવેજો તેમજ બીડ એપ્લિકેશ

મને અન્ય ફોર્મ કંપનીની વેબસાઇટ ઝ્ઝ.કુર્જ્ફ્સ્ઝ્ઝક્ડ.ફ્રક્ડ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. એક) આઇબીસી, ૨૦૧૫ ની કલમ ૨૯ એ હેઠળ ઇઓઆઇ, એપ્લિકેશન કોર્મ અને તમામ જણાવેલ દસ્તાવે૧ તેમજે અંડરટેકિંગ આપ્યા પછી દરેક સ્વતંત્ર લાયક બિડરોને ફડ્યા અધકારીની સંતુષ્ટી પર વેચાણ નોટીસ અને ઇ–હરાજી પ્રક્રિયા દસ્તાવેજો મુજબ પ્રવેશ આપવામાં આવશે. આ સંબંધમાં ફડ્યા અધિકારીનો નિર્ણય તમા લાગતી વળગતી વ્યક્તિઓ માટે અંતિમ અને બંધનકર્તા રહેશે.

એચ ) કડ્યા અધિકારી ઈ-હરાજા શરતોમાં કેરકાર કરવાનો હક અનામત રાખે છે અને કોઇપણ કારણ જણાવ્ય વગર અથવા કોઇપણ અનય્ નોટીસ અથવા જ્વાબદારી વગર કોઇપણ અથવા તમામ બીડોનો સ્વીકાર અથવ ખરવીકાર અથવા ઇ–હરાજી નાળુદ/મોકુફ/મુલતવી/વિલળીત/ રદ અથવા કોઇપણ મિલકત અથવા તેના કોઇ હિસ્સાને ઈ–હરાજી પ્રક્રિયામાંથી બાકાત કરવાનો અને કોઇપણ અરજદારને કોઇપણ સ્તરે કોઇપણ ભાવી

જા) ઈ-હરાજા નિચત તારીખે બપોરે ૨.૦૦ વાગ્યા થી સાંજે ૫.૦૦ વાગ્યા દરમિયાન પાંચ મિનિટના અનલિમીટે

આઇ) તમામ લાગુ વેરા સફળ બીડરે ભોગવવાના રહેશે. સુપ્રિયો કુમાર ચૌધરી ફડયા અધિકારી, જેવીએલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ IBBI/IPA-001/IP-P00644/2017-18/11098 liquidatorjvl@lgjvl.com, બીડીઓ રીસ્ટ્રક્ચરીંગ એડવાઇઝરી એલએલપી સી/ઓ.બીડીઓ ઇન્ડિયા એલએલપી, ડકબેક હાઉસ, ચોથો માળ

#### **UCO BANK** (A Govt. Of India Undertaking) HONOURS YOUR TRUST વેચાણ નોટીસ ઈ - હરાજી

રખિયાલ શાખા : તિરૂપતિ એસ્ટેટ, અનિલ સ્ટાર્ચ મીલ રોડ, સરસપુર, અમદાવાદ. તા. ૧૦.૦૬.૨૦૨૨ ના રોજ બપોરે ૧.૦૦ થી સાંજે ૪.૦૦ કલાક સુધી

સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ ૧૩(૨) મુજબ આથી જાહેર જનતાને અને નીચે જણાવેલ ઉધારકર્તાઓ / જામીનદારો / મોર્ગેજરો (અહીં ઉધારકર્તા તરીકે ઓળખાય) ને અધિકૃત અધિકારી દ્રારા **ડીમાન્ડ નોટીસ તા. ૧**૯.**૦૧.૨૦૨૨** માં જણાવ્યા મુજબ બાકી નિકળતી રકમ **રૂા. ૩૯,૪૯,૬૮૫.૬૬ (અંકે ઓગણચાલીસ લા**ખ **ઓગણપચ્ચાસ હજાર છસ્સો પચ્ચાસી અને છાસઠ પૈસા પુરા)** વત્તા તા. ૨૫.૦૮.૨૦૨૧ ના રોજ થી (તા. ૩૧.૦૭.૨૦૨૧ ના રોજ થી વ્યાજ સહીત) ચુકવવા જણાવેલ. સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રૅક્શન ઓફ ફાઈનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ મુજબ યુકો બેંક, અધિકૃત અધિકારીશ્રીએ મિલકતોનો **તા. ૧૨.૦૪.૨૦૨૨**ના રોજ **સાંકેતિક કબજો** લઈ લીધેલ છે. **ગુરુકૃપા સેલ્સ** એજન્સી, પ્રો. જ્**યે**શક્રુમાર **જેન, ૧હ/ંઽ૬, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રખિયાલ, અમદાવાદ, ગુજરાત** ખાતાઓમાં લોન / ક્રેડીટ ફેસીલીટી બેંકનાં બાકી નીકળતાં નાણાં વસૂલ કરવા માટે મિલકતોનું ધોરણે વેચાણ કરવામાં આવશે. યુકો બેંકની બાકી રકમ **રૂા. ૩૯,૪૯,૬૮૫.૬૬** વત્તા તા. ૨૫.૦૮.૨૦૨૧ ના રોજે થી વ્યાજ અને ખર્ચાઓ વસુલાત માટે મુકરર મિલકતોનું જાહેર ઈ - હરાજી દ્રારા વેચાણ કરવામાં આવશે. સામાન્ય જનતાને વ્યક્તિગત રીતે અથવા યોગ્ય રીતે અધિકૃત એજન્ટ દ્રારા બોલી લગાવવા આમંત્રીત કરે છે.

મુક્સ્ટ મિલકતનું શિડચુલ						
ઉદ્યારકર્તા / જામીનદારોનું નામ	બાકી લ્હેંણી રકમ	મિલકતનું વર્ણન	અનામત કિંમત અને ઈએમડી			
ગુરુકૃપા સેલ્સ એજન્સી, પ્રો. જયેશકુમાર જેન, ૧૯/૬૬, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રખિયાલ, અમદાવાદ, ગુજરાત	રૂા. ૩૯,૪૯,૬૮૫.૬૬ વત્તા તા. ૨૫.૦૮.૨૦૨૧ ના રોજ થી વ્યાજ અને આકસ્મિક ખર્ચાઓ સાથે	સ્થાવર મિલકતનો ઘર જેનું ક્ષેત્રફળ ૪૧.પ૩ સ્કે.મી., ઘર નં. ૬૬, બ્લોક નં. ૧૭, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રખિયાલ, અમદાવાદ, ગુજરાત.	Rs. 28,90,000/- 			

🌑 ઈ - હરાજી ની તારીખ અને સમય : ૧૦.૦૬.૨૦૨૨, સમય : બપોરે ૧.૦૦ થી સાંજે ૪.૦૦ વાગ્યા સુર્ધ ● ઇએમડી ભરવાની છેલ્લી તારીખ : ૦૮.૦૬.૨૦૨૨ ના રોજ થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી વેચાણ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ - ૨૦૦૨ હેઠળ ની શરતો અને નિયમો ને આધિન રહેશે

નિરીક્ષણ ની તારીખ અને સમય : ૦૨.૦૬.૨૦૨૨, સમય : બપોરે ૧.૦૦ થી સાંજે ૪.૦૦ કલાક સુધી

(૧). "જ<mark>યાં છે જેમ છે અને જે કંઇ પણ છે ના ધોરણે</mark>" વેચાણ કરવામાં આવશે. (૨). ઉપર જણાવેલ નિર્દિપ્ટ મુકરર મિલકતોની વિગતો, અધિકૃત અધિકારીની માહીતીમાં શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું છે, પરંતુ અધિકૃત અધિકારી આ ઘોષણામાં કોઈ

ભુલ, ખોટી રજુઆત અથવા અવગણના માટે જવાબદાર રહેશે નહિં. (૩). મુકરર મિલકત અનામત કિંમત કરતા નીચે વેચવામાં આવશે નહિં. (૪). હરાજીનું વેચાણ ઈ - હરાજી પોર્ટલ <u>https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp</u> કારા ઓનલાઈન કરવામાં

(૫). બિડરોને પણ <u>https://ibapi.in</u> or www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp પોર્ટલ દ્રારા જોઈ જવાની સલાહ

(૬). સંભવિત બિડરોએ વધુ માહિતી મેળવવા માટે <mark>શ્રી શંકરપ્રસાદ મિશ્રા, અધિકૃત અધિકારી (મો. નં. ७૮७૩૦૧૬૮૨૧) નો સંપર્ક કરી શકે છે.</mark> તારીખ : ૦૯.૦૫.૨૦૨૨ અધિકૃત અધિકારી, ચુકો બેંક (અસલ અંગ્રેજીથી અનુવાદ) સ્થળ : અમદાવાદ

GO COLORS!

Place: Mumbai

Date: May 07, 2022

#### **GO FASHION (INDIA) LIMITED** (Formerly Known as GO FASHION (INDIA) PRIVATE LIMITED

CIN: L17291TN2010PLC077303

Registered Office: Sathak Center, 5th Floor, New No.4, Old No.144/2, Nungambakkam High Road, Chennai, Tamil Nadu 600 034. Website: www.gocolors.com

Extract of Audited Financial Results for the Quarter and Year Ended 31st March, 2022 (INR in Lakhs, except Earnings Per Share data, unless otherwise stated)

S.		QUARTER ENDED			YEAR ENDED	
No.	Particulars	31-03-2022 (Unaudited)	31-12-2021 (Unaudited)	31-03-2021 (Unaudited)	31-03-2022 (Audited)	31-03-2021 (Audited)
1.	Total income from operations	11,944.79	14,522.04	9,569.28	42,210.69	28,225.27
2.	Net Profit / (Loss) for the period (before Tax,					
	Exceptional items)	1,517.60	3,298.42	941.99	4,787.64	(313.45)
3.	Net Profit / (Loss) for the period before Tax (after					
	Exceptional items)	1,517.60	3,298.42	941.99	4,787.64	(313.45)
4.	Net Profit / (Loss) for the period after Tax (after					
	Exceptional items)	1,230.08	2,369.17	712.36	3,560.08	(353.84)
5.	Total Comprehensive income for the period					
	{Comprising Profit / (Loss) for the period (after Tax)	1,269.68	2,361.84	717.72	3,577.70	(336.02)
	and other Comprehensive income (after Tax)}					
6.	Paid-up Equity Share Capital (face value of ₹ 10/- each)	5,400.90	5,400.90	3,000.01	5,400.90	3,000.01
7.	Other Equity (excluding Revaluation Reserve) as shown					
	in the Audited Balance Sheet of the Previous year	-	-	-	38,439.84	20,394.33
8.	Earnings Per Share (of ₹ 10/- each)					
	(for continuing and discontinued operations):					
	a) Basic	2.28	4.48	1.36	6.74	(0.68)
	b) Diluted	2.28	4.48	1.36	6.74	(0.68)

Place: Chennai

Date: May 07, 2022

The above is an extract of the detailed format of Quarterly and Year to Date Ended Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Year to Date Ended Audited Financial Results are available on the websites of the Stock Exchanges www.nseindia.com and www.bseindia.com) and on the Company's website (www.gocolors.com). The Financial Results have peen duly approved by the Board of Directors at their meeting held on May 07, 2022.

> For Go Fashion (India) Limited (Formerly Known as GO FASHION (INDIA) PRIVATE LIMITED) Prakash Kumar Saraogi - Managing Directo DIN No.00496255

તારીખ: ૯ મે, ૨૦૨૨

અરજદારને ગેર લાચક ઠરાવવાનો અબાધિત હક ધરાવે છે.

૪૧, શેક્સપીચર સારણી, કલકત્તા-૭૦૦૦૧૭, ભારત

વ્યક્તિ : શ્રી શંકરપ્રસાદ મિશ

(અધિકૃત અધિકારી)